

કેન સર અને તેના જેવા અન્ય અસાધ્ય યોગોમાં પથેશન બદ થઈ અસહ્ય દુખાવા અને ભયે દવાની આડઅસરથી બચવા મટે ‘થેએસકિ ડી.આર.બી. ટ્રેડિયોફ થકિવન સી’ ક આદર્ય શ વકિલ પ બની શકે છે. તજેત્તમ પોલો હોસ પટિલમં નેથેબીથી આવેલી અસહ્ય પીડાથી કણસતે સ ત્ત કેન સથની મ્હલિા દથ દીને મતી થ ક સોચ દ વાય અવાજના તંગોથી સાથ્વાથ આપીને દથ દુમ્ક ત કથયાનો કસિ સો પ ઠકાશમં આવયો છે.



કેન સર અને તેના જેવા અન્ય અસાધ્ય યોગોમાં પથેશન બદ થઈ અસહ્ય દુખાવા અને ભયે દવાની આડઅસરથી બચવા મટે ‘થેએસકિ ડી.આર.બી. ટ્રેડિયોફ થકિવન સી’ ક આદર્ય શ વકિલ પ બની શકે છે. તજેત્તમ પોલો હોસ પટિલમં નેથેબીથી આવેલી અસહ્ય પીડાથી કણસતે સ ત્ત કેન સથની મ્હલિા દથ દીને મતી થ ક સોચ દ વાય અવાજના તંગોથી સાથ્વાથ આપીને દથ દુમ્ક ત કથયાનો કસિ સો પ ઠકાશમં આવયો છે.

પોલો હોસ પટિલનાં પેઘન મેનેજમેન્ટ કન સલટન ટ અને કો-ડિરેક્ટર ડ . થબીવ હથ ધે જણાવયું હતું કે, નેથેબીની બવન વથ ધીચ મ્હલિા દથ દી વીનીને સ ત્ત કેન સથના પથેશન બદ કેન સથનો ફેલાવો તી થયથી ચથ મ્હકામંથી છાતેની નસો જોડાથ હોચ તેમાં ક મ્હકામં વઘથે થ્યો હતે. જેથી તેને છાતેની ડાબે-જમ્થી બજુ તથ પીઠમં અસહ્ય દુખાવો થઈ સીદુપડથે ઠેસી તેજ સૂથ પણ શકતે ન હતે.

મ્હત વની વાત છે કે, અસહ્ય દુખાવાથી પીડાતે મ્હલિાને ‘થેએસકિ ડી.આર.બી. ટ્રેડિયોફ થકિવન સી’ (અવાજનાં તંગોથી સાથ્વાથ)ની સાથ્વાથી દુખાવો ગાયઠ થ જત તી થય કલાક બદ હથે-ફથે થથ છે. આ પ ઠકાથની ઠલીફ છાતે-ગથનને ભગે હોચ તીચાથે તીચાં અસંખ્ય નસો આવેલી હોચ જેથી ક સ-થે કંટ થેલ મ્શીન દ વાય તીચાં સુધે પહોંચ્યામં ડોક ટથની નપિણત મ્હત વનો ભગ ભવે છે. પહેલાં આ પ ઠકાથના દથ દમં મેથફીન જેવી ભથે મેડસિનિ અને વથ ટગિોપ લાસ ટીનું પથેશન કથ્યામં જોખમ વધુથ્હેતું હતું.

‘વિદ્યા યુનિવર્સિટી યુનિવર્સિટી યુનિવર્સિટી યુનિવર્સિટી યુનિવર્સિટી’ યુનિવર્સિટી ?

અસહ્ય દુખાવાથી પીડાત દથ દીને ઊંઘ સૂવડાવીને લાઘવ ક સ-થે કંટ થેલ મ્શીનથી દુખાવો થથે હોચ તેમ્હકામંથી નીકળતે નસોની જગયા શોધ્યામં આવે છે. તેજ ક સ-થે મ્શીનથી જોત-જોત તીચાં સુધે (ઘન જેકશન સોચની સાથઝ જેટલી વધુલંબઘની) સોચ પહોંચડાય છે, તેમંથી વાળ જેવા પાતળા ફાથબ નાખીને દુખાવાની જગયાનું ટેસ ટગિ કથીને ‘થેએસકિ ડી.આર.બી. ટ્રેડિયોફ થકિવન સી’ (અવાજનાં તંગોથી સાથ્વાથ)ની સાથ્વાથ આપીને તીચાંથી ઉદ ભવત દુખાવાના સંવેદનો અટકાવી દેવાથ છે.

કયાં યોગમં કામ લાગી શકે ? : કથેડથજ જુના મ્હકા, કેન સર અને શથીથનાં કોઘપણ અવચવની નસનાં દુખાવામં ઉપયોગી. ખાસ કથીને કમ્થ, ગથન, મ્હકા, ગાદીનો સોજો-દુખાવો, હાથપગમં નસ દબતે હોચ તેજ મ્નોપોઝ બદ મ્હલિા મં હાડકાં પોચ થ્યાની સમ્સયામં દથ દીના દુખાવાને ધીયાનમં થખીને પેઘન મેનેજમેન્ટ કથ્યું જૂથી છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source: [Divyabhaskar](#)